



# LGBTIQ સમુદાયોમાં ઘરેલુ અને પારિવારિક હિંસા

## ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ અને પારિવારિક હિંસા સ્વીકાર્ય નથી.

સમલિંગી સ્ત્રી (Lesbian), સમલિંગી પુરુષ (Gay), દ્વિલિંગી (Bisexual), વિપરીતલિંગી (Transgender), મધ્યલિંગી (Intersex) અને ક્વીઅર (Queer) એટલે કે LGBTIQ તરીકે ઓળખાતા લોકોને ઓસ્ટ્રેલિયામાં સમાન હકો છે, અને કોઈ પણ ભેદભાવ ગેરકાયદેસર છે.

ઓસ્ટ્રેલિયામાં બધા સંબંધો કાયદા હેઠળ સમાન છે. આનો અર્થ એ છે કે સમલિંગી યુગલો સહિતના બધા યુગલોને સંબંધમાં હોવાનો કે લગ્ન કરવાનો હક છે.

દરેક વ્યક્તિને તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનો સાથે હકારાત્મક અને સુરક્ષિત સંબંધો અનુભવવાનો હક છે.

ઘરેલુ અને પારિવારિક હિંસા આચરવી એ કાનૂની ગુનો છે. આવા ગુના કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોય તો **000** પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમના પર વિશ્વાસ કરી શકાય છે.

મફત અને ખાનગી સલાહ અને માહિતી માટે 1800RESPECT ને **1800 737 732** પર ફોન કરો.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો **131 450** પર ફોન કરો.

## ઓસ્ટ્રેલિયાની સરકાર કોઈ પણ સંજોગોમાં ઘરેલુ અને પારિવારિક હિંસા ચલાવી લેતી નથી.

ઘરેલુ અને પારિવારિક હિંસામાં જે તે સાથી અથવા તેમના પરિવારને બીક બતાવીને અથવા તેમની સલામતી માટે જોખમ ઊભું કરીને તેમને કાબૂમાં રાખવાના હેતુથી કરવામાં આવતાં વર્તન કે અપાતી ધમકીઓનો સમાવેશ થાય છે. ઘરેલુ અને પારિવારિક હિંસામાં નીચેનાં કૃત્યોનો સમાવેશ થઈ શકે છે:

- મારપીટ;
- શ્વાસ રૂંધવો;
- સાથી કે પરિવારને જરૂરિયાત મુજબનાં પૈસા ન આપવા;
- સાથીને મિત્રો અને સગાંસંબંધીઓથી દૂર રાખવાં, મળવા ન દેવાં;
- સાથીનું અપમાન કરવું કે સતત ટીકા કરતાં રહેવું; અથવા
- બાળકોને કે પાલતુ પ્રાણીઓને નુકશાન પહોંચાડવાની ધમકી આપવી.

LGBTIQ સંબંધોમાં થતી ઘરેલુ અને પારિવારિક હિંસામાં નીચેનાં કૃત્યોનો પણ સમાવેશ થઈ શકે છે:

- સાથીની વિરુદ્ધ તેમના ઇન્ટરસેક્સ સ્ટેટસ, જાતીયતા, લિંગ, લૈંગિક અભિવ્યક્તિ, ટ્રાંસજેન્ડર અથવા HIV સ્ટેટસનો ઉપયોગ કરવાની ધમકી આપવી;
- સાથીના પરિવાર, મિત્રો સમક્ષ, સમુદાયમાં અથવા કાર્યસ્થળે તેની જાતીય ઓળખ જાહેર કરી દેવાની ધમકી આપવી;
- સાથીની દવાઓ અથવા લિંગ પરિવર્તન સંબંધિત આરોગ્ય સંભાળ સુધીની પહોંચ પર નિયંત્રણ મૂકવાં; અથવા
- સાથી પર લિંગ કે જાતિનાં ધોરણોનું પાલન કરવા માટે દબાણ કરવું.

## ઓસ્ટ્રેલિયામાં બીજી સહાય સેવાઓ છે જે મદદ કરી શકે છે.

ACON, LGBTIQ લોકોને અસર કરતાં પારિવારિક અને ઘરેલુ હિંસા સહિતના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ વિશે મફત માહિતી આપે છે. LGBTIQ માટે મદદ આપતી સમાવેશક સેવાઓની ડિરેક્ટરી માટે **ACON**ની વેબસાઇટ [www.acon.org.au](http://www.acon.org.au) પર જાઓ.

**1800RESPECT** એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર અને ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનાર તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

**1800 737 732** પર ફોન કરો અથવા **1800RESPECT** ની વેબસાઇટ [www.1800RESPECT.org.au](http://www.1800RESPECT.org.au) પર LGBTIQ માટેના વિશિષ્ટ માહિતીના વિભાગની મુલાકાત લો.

## શું તમારે દુભાષિયાની જરૂર છે?

**131 450** પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (TIS) માટે ફોન કરો . TIS માંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરી શકે છે. જોકે, TIS સલાહ સૂચન કરતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.